

4. થોન્ક યૂ, મિસ્ટર સેકેટરી

ડૉ. કિરણ બેદી

જન્મ : ૮ જૂન ૧૯૪૮



ડૉ. કિરણ બેદીનો જમ જૂન ૮, ૧૯૪૮ના દિને પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં થયો. તેઓ શ્રીમતી પ્રેમલતા તથા શ્રી પ્રકાશલાલ પેશાવરિયાની ચાર પુત્રીઓ પૈકી બીજા કમે જન્મ્યા હતા. ડૉ. કિરણ બેદી એમના માનવીય તેમજ નિડર દ્રષ્ટિકોણના કારણે પોલિસ કાર્યપ્રણાલી તથા જેલ સુધારણા માટેના અતિ આધુનિક આયામો સર કરવામાં મહત્વાનું યોગદાન કરી શક્યા છે. ડૉ. કિરણ બેદી ભારતીય પોલિસ સેવાના પ્રથમ વરિષ્ઠ મહિલા અધિકારી છે. તેઓએ ડિસેન્બર ૨૦૦૭માં સ્વૈચ્છિક લઈ સમાજસેવાનો રસ્તો પસંદ કર્યો. એમને શૌર્ય પુરસ્કાર ઉપરાંત રમન મેંગસેસે પુરસ્કાર

વડે એમને નવાજવામાં આવ્યા છે. તેઓ એશિયાઈ ટેનિસ રમતના ચેમ્પિયન રહી ચૂક્યા છે. એમણે કાયદાશાસ્ત્રમાં સનદ મેળવ્યા પછી સાથે સાથે 'ડ્રગ એબ્યુઝ એન્ડ ડોમેસ્ટિક વાયોલેન્સ' વિષય પર ડૉક્ટરેટની ઉપાધિ પણ પ્રાપ્ત કરી. એમણે 'ઇંટ્રસ ઓફ્વેઝ પોસિબલ' તથા બે આત્મકથાઓ 'આઈ ડેર' તેમ જ 'કાઈન્ડલી બેટન' નામનાં પુસ્તકો પણ લખ્યાં છે.

કોઈ વિશેષ વ્યક્તિને એમ લાગે કે પોતાના જીવનના પ્રસંગો જાહેર જનતાને ઉપયોગી થાય એમ છે તો તે પોતાને વિશે લખે છે. ભારતીય સંસ્કાર પ્રમાણે તો પોતાને વિશે પોતે વાત કરવી એ યોગ્ય ગણાતું નથી. પણ અંગ્રેજી ભાષામાં આવાં પોતાને વિશે પોતે જ લખેલાં અનેક પુસ્તકો મળે છે. તેની અસરથી આપણી ભાષાઓમાં પણ આત્મ એટલે કે પોતાને વિશેની કથા કહેવા-લખવાની પરંપરા ચાલી છે.

આ સાહિત્યપ્રકાર જીવનલક્ષી છે. વ્યક્તિ પોતે પોતાના જ જીવનના પ્રસંગો લખે છે. એક રીતે એમાં જરા પણ કલ્પનાનું મિશ્રાણ ન ચાલે. એ નક્કર વાસ્તવિકતાની, ખરેખર જે કશું બન્યું હતું તેની જ વાત હોય. અલબત્ત જે બન્યું હતું તે વિશેનાં પોતાનાં અર્થઘટન, દસ્તિબંદુ, અભિપ્રાય લખવાની લેખકને છૂટ હોય. પણ એ વ્યક્તિના પોતાના જીવનનો ઈતિહાસ છે. આ કારણે એ કલા કરતાં શાસ્ત્ર વધુ ગણાય. બહુ બહુ તો તેને જ્ઞાનલક્ષી અથવા માહિતીપ્રધાન સાહિત્ય ગણી શકાય. જેને પોતાની રોજનીશી (રોજ બનતી પોતાના જીવનની ઘટનાઓની નોંધ) લખવાની ટેવ હોય, પોતે લખેલા પત્રોની નકલ સાચવી રાખવાની આદત હોય અથવા જેની યાદશક્તિ જબરી બળવાન હોય તેઓ જ આત્મકથા લખી શકે. વળી જેઓ પોતાના વિશે પણ તટસ્થ હોય, આખાબોલા અથવા સત્યવાદી હોય તે પોતાના જીવનઘડતરની વાત લખી શકે. એમાં કોઈ વ્યક્તિ નહીં પણ 'સત્ય' નાયક હોય અને 'વાસ્તવિકતા' નાયિકા હોય.

ગુજરાતી સાહિત્યમાં મહાત્મા ગાંધીજીની 'મારી આત્મકથા અથવા સત્યના પ્રયોગો' ઉત્તમ (કદાચ જગતની સર્વશ્રેષ્ઠ) આત્મકથા થઈ છે.

ઈન્ટિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે દિલ્હીમાં કેઈન બેદી તરીકે જાણીતાં કિરણ બેદીના જીવનનો આ પ્રસંગ છે.

આ આત્મકથાખંડમાં તેમણે પોતે જીવનને કઈ રીતે સકારાત્મક રીતે જોયું તેની વાત છે. ટેનિસનાં નેશનલ જુનિયર ચેમ્પિયન હોવાથી તેમણે વિભાગનાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રમવાનું સપનું સેવવું. પણ ગુમાની સેકેટરીએ એ રોળી નાખ્યું. એનો બહુ લાંબો અફસોસ કરવાને બદલે તેમણે ભણતર ઉપર ધ્યાન આપ્યું અને ભારતનાં પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર થયાં. તમને આમાંથી પ્રેરણા મળશે.

ખેલ-પ્રેમીઓના કુટુંબમાં હું ઉછરી છું. મારા પિતાજી ટેનિસના નેશનલ ચેમ્પિયન હતા. મારી મા બેડમિન્ટનની ખેલાડી હતી.

સ્કૂલ પૂરી થાય પછી હું ટેનિસ કોચિંગ સેન્ટર પહોંચ્યો. ત્યાં અમારું આપ્યું કુટુંબ ભેગું થતું.

મા ફળો, ગરમ દૂધ, ટેનિસનાં કપડાં ધરેશી લઈ આવતી. મારી નાની બેન રીતા પણ સ્કૂલ છૂટાં ત્યાં ઢોરી આવતી.

અમે અમારા વારાની વાટ જોતાં બાજુના બાંકડે બેસતાં. વચ્ચે વચ્ચે હોમ-વર્ક પણ પતાવતાં.

ટેનિસની સ્પર્ધાઓમાં રમવા હું આખા દેશમાં ફરતી.

તે સમયે ખાસ પૈસા નહીં. રિઝર્વેશન વિના ટ્રેનમાં મુસાફરી થતી. ભાગ્યે બેસવાની જગ્યા મળતી. રમ્યા પહેલાં જ ખાસાં થાકી જતાં.

જો કે ત્રીજા વર્ગની મુસાફરીનો ફાયદો થતો. વિદ્યાર્થીઓને અડખી કિંમતે ટિકિટ મળતી. પણ એ માટેનું કન્સેશન ફોર્મ મેળવવું મુશ્કેલ હતું.

ટેનિસ એસોસિએસનાં સેકેટરી આ ફોર્મ આપતા તેથી ઘણા મહત્વના માણસ હતા. અરજી કરનારાઓને લાંબી વાટ જોવડાવી તે પોતાનું મહત્વ સાબિત કરતા.

ક્યારેક તો આખો દિવસ બગડતો. હોમવર્ક હોય. પરીક્ષાઓ હોય. ટેનિસની પ્રેક્ટિસ કરવાની હોય. ફિટનેસ માટેના વધારાના વર્ગો હોય. આવે સમયે સાવ ધીમી ગતિએ આગળ વધતી કતારમાં ઊભા રહેવાનું હોય.

હું મજબૂરી અનુભવતી. ગુર્સે થતી મુઢીઓ બાંકડા પર પદ્ધાડતી.

એવા એક પ્રસંગે, કતારમાં કલાકો તથ્યા પછી મારો વારો આવ્યો. હું મારી જાતને રોકી શકી નહીં. ગંભીર અવાજે મેં સેકેટરીને કહ્યું, ‘બીજાનો ખ્યાલ કરવાનું હું તમારી પાસે શીખી. હું મોટી થઈશ ત્યારે કોઈને આ રીતે વાટ જોવા દઈશ નહીં. બીજાના સમયનું મૂલ્ય આંકીશ.’

સેકેટરી ગુર્સે થઈ ગયા. તમે ધારી શકો છો કે તેમણે શું કર્યું ?

ટેનિસની હું જુનિયર નેશનલ ચેમ્પિયન હતી. માપદંડો પ્રમાણે પ્રતિષ્ઠિત વિભાગનમાં રમવાના નોભિનેશન માટે હક્કદાર હતી. આ સ્પર્ધામાં રમવાનું મારું સપનું હતું. સેકેટરીએ મારે બદલે અન્યને પસંદ કરી બદલો લીધો.

મને ઘણો અફસોસ થયો. પણ પછી ટેનિસને બદલે મેં મારા અભ્યાસમાં ધ્યાન આપ્યું. સખત પરિશ્રમને કારણે મારા વર્ગમાં ટોચે પહોંચી ગઈ.

આજે હું મારી જિંદગીમાં પાછું વળીને જોઉં છું ત્યારે અફસોસ નથી, સંતોષ છે. ઘણો મૂલ્યવાન પાઈ ભણાવવા માટે સેકેટરીનો અભાર માનું છું.

જેને પ્રજાના સમયની કિંમત છે તેવી સારી પોલિસ ઓફિસર બનવામાં તે મને મદદરૂપ થયા.

ટિપ્પણી

વાટ જોવી - રાહ જોવી ખાસાં - બહુ કલાર - હાર, લાઈન

દૃઢિપ્રયોગ

મુઢીઓ પછાડવી - ગુસ્સો કરવો

ટોચે પહોંચવું - સફળ થવું

પાછું વળીને જોવું - ભૂતકાળનાં સંસ્મરણો તાજાં કરવાં

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યમાં ઉત્તર આપો.

- લેખિકાનાં માતા-પિતા કઈ રમતનાં ખેલાડી હતાં ?
- કિરણ બેદી સેકેટરીની રીતભાત જોઈને કઈ પ્રતિજ્ઞા લે છે ?
- ક્યો પાઠ ભણાવવા બદલ લેખિકા સેકેટરીનો આભાર માને છે ?

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂકમાં આપો.

- કિરણ બેદીનું કુટુંબ ખેલ પ્રેમી હતું એવું શા ઉપરથી કહી શકાય ?
- કિરણ બેદીના મતે ત્રીજા વર્ગની મુસાફરીના ક્યા લાભાલાભ છે ?
- સેકેટરી શા માટે બહુ મહત્વના માણસ ગણાતા ?
- કિરણ બેદીનો દિવસ કેવીરીતે વેડફાઈ જતો ?
- સેકેટરીએ બદલો લીધો છતાં લેખિકા તેમનો આભાર શા માટે માને છે ?

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

- સેકેટરીએ કેવી રીતે બદલો લીધો ?
- ટેનિસ સ્પર્ધામાંથી બાકાત થઈ જવા છતાં લેખિકાને શા માટે અફ્સોસ થતો નથી ?
- કોઈ વસ્તુ મેળવવા માટે તમારે ખૂબ જ રાહ જોવી પડી હોય તે ઘટનાનું વર્ણન કરો.
- જ્યારે તમારો સમય બરબાદ થાય છે ત્યારે તમને ક્યા વિચારો આવે છે તે જણાવો ?
- ડૉ. બેદીના ક્યા ગુણોનું અનુસરણ કરશો ? શા માટે ?

પ્રશ્ન 4. સમાનાર્થી શબ્દ લખો.

કુટુંબ, મજબૂરી, મૂલ્ય, પરિશ્રમ

પ્રશ્ન 5. વિરુદ્ધાર્થી શબ્દ લખો.

ફાયદો, મુશ્કેલ, ટોચ, સંતોષ

આટલું કરો

- શિક્ષકના માર્ગદર્શન હેઠળ ‘સમયપાલનનું મહત્વ’ વિષય પર કોઈનું વક્તવ્ય યોજો.
- સમયપાલનની પ્રેરણા આપતા સુવિચારો શાળાના બ્લેકબોર્ડ પર લખો.
- પ્રિયકાંત મણિયારની રચના ‘સમયનું સોનું’ મેળવીને વર્ગિંડમાં પઠન કરો.



વ्याकरण

રૂઢિપ્રયોગ

“ને કેમ જાણ્યું કે પહેલા ગ્રાણમાં તું આવીશ ?” ચોથોય વાતમાં પડ્યો.

“એમ તો નહીં પણ પહેલો આવીશ.” મહાદેવે સગર્વ કહ્યું.

“કહેવાય નહીં હો મહાદેવ” વડાએ કહ્યું, “આડે દિવસે દોડે ને દશેરાએ ન ય દોડે.”

ગ્રીજો બોલ્યો, “મહિયાને તું કમ ન જાણતો, છધા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી ?”

ચોથો બોલી ઉઠ્યો, “તે નટુડો ઓછો છે કે ? એમાં પાછા એના બાપા હેડમાસ્તર છે.”

મહાદેવ ન ડગ્યો, “ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત. ખાલી તમે ઘોડાં દોડાવો છો.”

વડાએ કહ્યું, “ઠીક ભાઈ, જોઈએ છીએ ને ! મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે.”

“હા, હા, દીવો બળે એટલે ! પહેલો નંબર લાવું.” મહાદેવ તાનમાં હતો.

“હા વળી, આપણા ગામનું નાક રહેશે. પહેલો આવીશ તો દર મહીને પંદર રૂપિયા, બીજાને દસ ને ગ્રીજો આવીશ તોયે પાંચ...”

તમારા પાઠ્યપુસ્તકમાં પત્રાલાલ પટેલ રચિત કૃતિ ‘પરીક્ષા’ કૃતિમાંથી ઉપરનો સંવાદ લેવાયો છે. તમે જો ધ્યાનથી વાંચો તો સંવાદની સચોટતા સાધનાર તત્ત્વ સહજતાથી પ્રયોજયેલ રૂઢિપ્રયોગ અને કહેવત છે. ઉપરના સંવાદમાં પ્રયોજયેલા રૂઢિપ્રયોગ - કહેવત તારવી શકો ? ચાલો, એ રૂઢિપ્રયોગ-કહેવતને અર્થ સહિત જોઈએ.

રૂઢિપ્રયોગ :

દશેરાએ ઘોડો ન દોડવો - ખરે પ્રસંગે નિષ્ફળ જવું

ઘોડાં દોડાવવાં - ખાલી મનોરથ કરવા, શેખ્યાલ્યી જેવા તરંગો કરવા

નાક રહેશે / નાક ઊંચું રહેવું - આબરુ રહેવી, માન પામવું, માન વધવું

કહેવત :

મામાનું ઘર કેટલે ? દીવો બળે એટલે - પોતની મંજિલથી નજીક હોવું તે.

ઉપરના સંવાદને ધ્યાનથી વાંચતાં તમે સમજ શકો છો કે રૂઢિપ્રયોગ - કહેવત જેવી બાબતથી કોઈ બાબતને કેટલી ટૂંકમાં, સચોટતાથી, સહજતાથી રજૂ કરી શકાય છે. તમે તમારા લખાણ, રોજિંદા ભાષાપ્રયોગમાં રૂઢિપ્રયોગ વણી લઈ શકો તો તમારી ભાષા વધુ સમૃદ્ધ થશે. અહીં કેટલાક રૂઢિપ્રયોગ આપેલ છે.

- | | |
|-----------------------------|--|
| 1. આંખ ખૂલી જવી | ચક્કિત બનવું, સમજ પડવી, સાચી પરિસ્થિતિ સમજવી |
| 2. આંખની કીકી હોવું | અતિપ્રિય હોવું |
| 3. આંખમાં ધૂળ નાખવી | છેતરવું, દગ્ગો કરવો |
| 4. આકાશ પાતળ એક કરવાં | કોઈ પ્રયાસ બાકી ન રાખવો |
| 5. ઊંઘ ઊરી જવી | ખૂબ ચિંતા થવી |
| 6. એક પગ કબરમાં હોવો | મૃત્યુ નજીક હોવું |
| 7. કળિયાનું મોં કાળું કરવું | કલેશથી વેગળા રહેવું |

- | | |
|---|-----------------------------------|
| 8. કડવો ધૂટડો ગળી જવો | અપમાન સહન કરી લેવું |
| 9. ફૂવામાંના દેડકા હોવું | સંકુચિત વિચારસરણીવાળા હોવું |
| 10. કોણીએ ગોળ લગાડવો | પોતાનું કામ સાધવા લાલચ આપવી |
| 11. જ્ઞભ ન ઉપડવી | બોલી ન શકવું |
| 12. જીવ અધ્યર થઈ જવો | ચિંતિત થવું |
| 13. જીવ બળી જવો | ખૂબ સંતાપ થવો |
| 14. ટાઢે પાણીએ ખસ જવી | વગર મહેનતે પીડા ટળવી |
| 15. દહી-દૂધમાં પગ રાખવો | બસે પક્ષમાં રહેવું |
| 16. ધૂળમાં મેળવવું | નિષ્ફળ કરવું |
| 17. નાક કાપવું | આબરુને કલંક લગાડવું; બેઈજજત કરવું |
| 18. નાના મોંએ મોટી વાત કરવી ગજા ઉપરાંતની વાત કરવી | |
| 19. નામ કાઢવું | પ્રસિદ્ધિ પામવું |
| 20. પથ્થર પર પાણી | વર્થ જવું |
| 21. પાણીમાં જવું | એળે જવું, નિરર્થક થવું |
| 22. બારમો ચન્દ્રમા હોવો | અણબનાવ હોવો |
| 23. બારે મેઘ ખાંગા થવા | મૂળશધાર વરસાદ પડવો |
| 24. મોં તોડી લેવું | અપમાન કરવું |
| 25. મોંમાં પાણી આવવું | કશુંક ખાવાનું અત્યંત મન થવું |
| 26. મોંમાં મગ ભરાઈ જવા | મુંગા થઈ જવું |
| 27. વાળ વાંકો ન થવો | કોઈ નુકસાન ન થવું |
| 28. હાથ ધોઈ નાખવા | આશા મૂડવી (૨) જવાબદારી છોડી દેવી |
| 29. હાથ પીળા કરવા | પરણાવવું |
| 30. હૈયે ટાઢક વળવી | મનમાં નિરાંત થવી |